

પ્રેસ નોટ

દુ વ્હિલર વાહનોની ચોરી કરતી વાહનચોર ગેંગના ૨ ઇસમોને પકડી પાડી કુલ-૪ વાહનો રીકવર કરી વાહનચોરીના ૪ ગુનાઓનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચ.

અમદાવાદ શહેર વિસ્તારમાં ઘણા સમયથી ચોરીઓનો ઉપદ્રવ વધી ગયેલ હોય અને આ વાહનચોરીના ગુનાઓના ભેદ વણ ઉકેલાયેલ હોય આ ગુનાઓનો ભેદ ઉકેલવા શ્રી જે.આર.મોથલીયા, સંયુક્ત પોલીસ કમિશ્નર ક્રાઇમબ્રાન્ચ તથા શ્રી દીપન ભદ્રન નાયબ પોલીસ કમિશ્નર ક્રાઇમબ્રાંચ નાઓ દ્વારા સુચના આપવામાં આવેલ હોય જે સુચના આધારે મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી બી.વી.ગોહીલ નાઓના માર્ગદર્શન હેઠળ પો.ઇ. શ્રી આર.એસ.સુવેરા નાઓની ટીમના પો.સ.ઇ. શ્રી વાચ.એમ.ગોહીલ, પો.સ.ઇ. શ્રી કે.કે.ડીડોડ નાઓ સ્ટાફના માણસો સાથે અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સ્ટાફના હેડ કોન્સ. મેહુલકુમાર જયંતીલાલ તથા હેડ કોન્સ. ધીરજકુમાર લક્ષ્મણભાઇ નાઓને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે આરોપીઓ (૧) આમીર સ/ઓ અનવરભાઇ હૈદરઅલી શેખ ઉ.વ.૨૦ રહે. મનં.૫૪, વકફ કમિટીની ચાલી, હાથીખાઇ, ચાર તોડા કબ્રસ્તાનની પાછળ, ગોમતીપુર, અમદાવાદ શહેર તથા (૨) અરદાદખાન ઉર્ફે સલમાનખાન સ/ઓ દોસમખાન પઠાણ ઉ.વ.૨૦ રહે. મનં.૧, અસ્મા ડુપ્લેક્ષ, સરતાજનગર, મદીના હોટલ આગળ, બેરલ માર્કેટ, દાણીલીમડા, અમદાવાદ શહેર નાઓને જમાલપુર ચાર રસ્તા પાસેથી પકડી પાડી તેઓ પાસેથી ચોરી કરેલ (૧) હિરો હોન્ડા સ્પ્લેન્ડર મો.સા. કિં.રૂ.૧૫,૦૦૦/-
(૨) પેશન પ્રો. મોટર સાયકલ કિં.રૂ. ૧૦,૦૦૦/-
(૩) હોન્ડા એક્ટીવા નંબર GJ-27-BC-4651 કિં.રૂ.૨૦,૦૦૦/-
(૪) હોન્ડા એક્ટીવા નંબર GJ-1-MB-8407 કિં.રૂ.૨૦,૦૦૦/-
મળી કુલ કિં.રૂ.૬૫,૦૦૦/- ની મત્તાનો મુદ્દામાલ કબજે લેવામાં આવેલ છે.

વાહનચોરીના કુલ-૪ ગુનાઓનો ભેદ ઉકેલાયો.

પકડાયેલ આરોપીઓની પુછપરછ કરતાં તેઓએ છેલ્લા ત્રણેક માસના ગાળામાં નીચે મુજબના ગુનાઓ આચરેલ છે.

- (૧) રખિયાલ પો.સ્ટે ફ.ગુ.ર.નં.૪૮/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯
- (૨) શહેરકોટડા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૨૬૩/૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯
- (૩) ગોમતીપુર પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૩૧/૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯
- (૪) આજથી દશેક દિવસ પહેલા સારગપુર બ્રિજ નીચેથી ચોરી કરેલ છે.

આરોપીઓની એમ.ઓ.

પકડાયેલ આરોપીઓ ટીવસના સમયે શહેર વિસ્તારમાં ફરી ચોરી કરવા લાયક વાહનોની રેકી કરતા અને રાત્રીના સમયે વાહનોની ચોરી કરતા હતા.

પકડાયેલ આરોપીઓએ આ સિવાય બીજા આવા પ્રકારના ગુનાઓ આચરેલ છે કે કેમ ? તેમજ તેઓની સાથે બીજા અન્ય આરોપીઓ સંડોવાયેલ છે કે કેમ ? તે બાબતે સઘન પુછપરછ તપાસ ચાલુ હોય જેથી બીજા પણ આવા પ્રકારના ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી સંભાવના છે.